

નબળાઈઓની સભાનતા જળવવી


એપ્રીલ - ૨૦૧૮

સારી પ્રક્રિયા સુરક્ષા સંસ્કૃતિ માટે નબળાઈઓની સભાનતા જળવવી એ એક અગત્યનું માપ છે. નબળાઈઓની સભાનતા જળવવી તેનો મતલબ શું છે? આનો અર્થ એવો છે કે તમારાં કારખાનામાં બધાં ને જ;

- તમારાં કારખાનામાં પ્રક્રિયા અને પદાર્થોના જોખમો વિશે ઉચ્ચ લેવલની જગ્યાતિ હોય,
- તેઓ સતત એવા ચિંહો તરફ તકેદારી રાખે જે ગંભીર ઘટનાઓ માટે પૂર્વભાસ કરાવે. જેમાં નીચરમીસ ઘટનાઓની જ્ઞાન કરવાનું સામેલ છે. (માર્ચ ૨૦૧૮ બીકન),
- ભૂતકાળની સારી કામગીરી અને સુરક્ષાના સારા રેકૉર્ડ ને કારણે અનુભવાતી આત્મસંતુષ્ટીને કયારેય માથા ઉપર ચડવા ન દે.

૫ એપ્રીલ, ૧૯૧૨ (૧૦૬ વર્ષ પહેલાં આજ મહીનામાં) સમુદ્રી જહાજ ટાઈટનીક ન્યૂઝિલાન્ડ જ કલાકની અંદર દુલી ગણ્યું જ્યારે તે ઉત્તરીય એટલાન્ટિક દીર્ઘામાં એક બરફના પહાડ સાથે ભટકાયું, જેનાથી ૧૫૦૦ થી વધારે વ્યક્તિત્વોના જાન ગયા. ટાઈટનીક ની બનાવટ અને ચલાવતી વખતે એવા ઘણાં બધાં દાખલાં હતાં જેમાં નબળાઈઓની સભાનતા ખોરવાઈ ગયી હતી. દા.ત.


- જહાજ કયારેય દુલી ન શકે તેવું માનવામાં આવ્યું હતું જેને કારણે કેટલાંક અગત્યના સુરક્ષા ના નિર્ણયો ખુબ નબળાં લેવામાં આવ્યાં હતાં. દા.ત. પાણી ન પ્રવેશો એવી બનાવટ મુખ્ય ડેક થી બે ડેક નીચે સુધી જ કરવામાં આવી હતી. લાઈફબોટને જરૂરી ન ગણતાં ૬૪ ની જગ્યાએ ૧૬ જ રાખવામાં આવેલી હતી, જેથી તે બધાં મુસાફરો અને કુ માટે પુરતી ન હતી.
- જહાજનો કપાન તેના જહાજ ચલાવવાની ક્ષમતા ઉપર અને જહાજ કદી દુલે નહીં તેવા અતિવિશ્વાસમાં હતો.
- માર્ગમાં તરતા બરફનાં પઢાડો હોવા છતાં જહાજ ખુબ ઝડપથી મુસાફરી કરી રહ્યું હતું. બીજા જહાજો એ બરફના પઢાડો વિશે ચેતવણી આપી હોવા છતાં જહાજની ઝડપ ઓછી કરવાનું કહેવામાં આવ્યું ન હતું.



F.G.O. Stuart (1843-1923) Public domain..



By Willy Stöwer, Magazine Die Gartenlaube, en:Die Gartenlaube and de:Die Gartenlaube, Public domain.



NOAA/Institute for Exploration/University of Rhode Island (NOAA/IFE/URI) Public domain.

શું તમે જાહોરી છો?

નબળાઈઓની સભાનતા જળવવામાં નિષ્ઠળતાં પ્રક્રિયા કારખાનામાં અક્સમાત થવા માટે એક કારણ છે. દા.ત. ડીસેમ્બર ૧૯૮૪માં બોપાલ, ભારતમાં ઝેરી ગેસ (મિથાઇલ આઇસો સાઇનેટ – એમઆઈસી) છુટ્યો જેને કારણે હજારો લોકોના મૃત્યુ થયા. આ દુખદ ઘટના પછી એવું જ્ઞાનવા મળ્યું કે કેટલીક અગત્યની સુરક્ષા પ્રણાલી ઘણાં લાંબા સમયથી કામ જ કરતી ન હતી.

- ગેસને સુરક્ષીત છોડવાના સ્ક્યુરિટી અને ફિલેર ટાવર બંધ હાલતમાં હતા.
- એમઆઈસીની સંગ્રહ ટાંકીને હંડી રાખતી પ્રણાલી ને બંધ હાલતમાં છોડી દેવાઈ હતી.
- જેને કારણે આ અક્સમાત ચાલુ થયો હતો તે પાણીની પાઈપને બ્લાઇન્ડ મારીને બંધ કરાઈ ન હતી, જેનાથી પાણીને ભળતું રોકી શકાય તેમ હતું.

તમે શું કરી શકો?

- તમારાં કારખાના પ્રક્રિયા અને પદાર્થોના જોખમો વિશે સમજો. સૌથી ભયાનક અક્સમાત શું થઈ શકે અને તેને બનતો રોકવા કયા પ્રકારની સુરક્ષા પ્રણાલીઓ અપનાવી છે અને કેવા સુરક્ષાના પગલાં લીધેલા છે તે વિશે જાહોરી. આ પ્રણાલી ઓ અને પગલાંઓ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યાં છે તે વિશે સમજો અને તેમાં કોઈ નૃતી જણાય તો મેજેજમેન્ટને તુરંત જાડો.
- એવું કયારેય ન વિચારો કે “એવું અહીં તો બની જ શકે” અથવા “એવું મારી સાથે તો નહીં જ શાયા”. પણ એવું બની શકે છે.
- તમારાં કારખાનાના દરેક વ્યક્તિમાં એવી સભાન જગ્યાતા કેળવવા પ્રોત્સાહીત કરો કે સૌથી ખરાબ બનાવ બની શકે છે અને એ કદાચ હમણાં જ થઈ શકે છે. જાહોરી કે આવું ન થાય તે માટે શું કરવું જોઈએ, બને તો શું કરવું જોઈએ અને કટોકટીમાં બચાવના પગલાં લેવા માટે હંમેશા તૈયાર રહો.
- તમારાં કારખાનામાં થઈ શકે તેવી ફક્ત સૌથી ખરાબ ઘટના જ નહીં પણ સંખ્યાબંધ ખરાબ ઘટનાઓની સંભવીત અસર શું થશે તે વિશે સમજો.

“જીવતા રાજ્યસ્થી છુટીને ભાગવાની ગણતરી ન કરો, જે તમે તેની નજીક રહેતા છોવ તો.”

-જે. આર. આર. ટોકી, ઘ હોનીટ, પ્રકરણ ૧૨

©AIChE 2018. All rights reserved. Reproduction for non-commercial, educational purposes is encouraged. However, reproduction for any commercial purpose without express written consent of AIChE is strictly prohibited. Contact us at ccts_beacon@aiche.org or 646-495-1371.